



COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સર્વિસમાં ફેરફારો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 19, 2020) – COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં અને બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પોતાના સમુદાયને સુરક્ષિત રીતે સેવા આપતી હોવાની ખાતરી કરાવવા, માર્ચ 23 થી શરૂ કરીને, બસ સર્વિસ નીચે જણાવ્યા પ્રમાણે ઘટાડવામાં આવશે:

સોમવારથી શુક્રવાર: શનિવારે વધારે સારી સર્વિસ – કેટલાક રૂટ્સ પર વધારાની સર્વિસ અને પસંદ કરેલા રૂટ્સ પર વહેલી સવારથી ટ્રિપ્સનો સમાવેશ થાય છે

શનિવાર: શનિવારે નિયમિત સર્વિસ

રવિવાર: રવિવારે નિયમિત સર્વિસ

શનિવારે વધારે સારી સર્વિસની વિગતો વેબસાઈટ bramptontransit.com પર શુક્રવાર, માર્ચ 20 નાં રોજ સાંજે 4:30 વાગ્યે આપવામાં આવશે.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટના ટર્મિનલ્સ અને તેનું સંપર્ક કેન્દ્ર સંચાલનના નિયમિત ક્લાકો જાળવશે. સંચાલન ક્લાકોમાં કોઈ ફેરફારની માહિતી વેબસાઈટ bramptontransit.com પર આપવામાં આવશે.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ એક નિર્ણાયક સેવા છે અને તે સમુદાયને સહાયરૂપ થવા કટિબદ્ધ છે. ગ્રાહકોના સહયોગ બદલ તેઓનો આભાર માનીએ છીએ.

સમુદાયમાં COVID-19 નો ફેલાવો ઘટાડવા, બ્રેમ્પટન ટ્રાન્ઝિટ નીચેની બાબતો અમલમાં મૂકશે:

- બસ પર ઉતારુઓની ભાર ક્ષમતા અડધી બેઠકની કરવામાં આવશે જેથી ઉતારુઓ વચ્ચે સામાજિક અંતર જાળવવાના આચરણોને ટેકો મળી રહે. આનો અર્થ એ થાય કે એકવાર બસો અડધી ભરાઈ જાય એટલે, સ્ટોપ્સ જતા કરવામાં આવશે અને કેટલાક ઉતારુઓ પાછળ રહી જાય તેવું બની શકે. બાકીના ઉતારુઓને લઈ જવા વધારાની બસ ઉપયોગમાં લેવા દરેક પ્રયત્ન કરવામાં આવશે.
- બહુ વ્યસ્ત રૂટ્સ પર, ઉતારુઓ બસમાં હોય તે વખતે તેઓ વચ્ચે સામાજિક અંતર જાળવવા ઉતારુઓની ક્ષમતામાં સહાયરૂપ થવા આર્ટિક્યુલેટેડ (સ્પષ્ટ ઉચ્ચારિત) બસો મૂકવામાં આવશે. આનો અર્થ એ થાય કે Züm (ઝુમ) આર્ટિક્યુલેટેડ બસો નિયમિત રૂટ્સ પર જોવામાં આવી શકે. કૃપા કરી બસો પરના ડેસ્ક્રિપ્શન (પહોંચવાના સ્થળ) ચિહ્નો પર ધ્યાન આપશો.
- બસ પર કર્મચારીઓ સહિતની દરેક વ્યક્તિ વચ્ચે પૂરતું અંતર હોવાની ખાતરી કરવા, બેઠકોને પીળી ટેપથી અવરોધવામાં આવશે અને ઉતારુઓને આ બેઠકો પર ન બેસવાનું કહેવામાં આવશે.

વધારે સારી સહાય અને ચેપનાશક સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજંદા ધોરણે સાફ અને ચેપરહિત કરવામાં



BRAMPTON

Service and Information Update

આવશે. ઉતારાઓને પ્રવાસ કરતી વખતે પોતાના અંગત ડિસઇન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઇઝર કે વાઇપ્સ સાથે રાખવા, અને પોતાના હાથ અવારનવાર ધોવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેજર્સ ઓફિસમાં પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ઠપણે કામ કરી રહ્યું છે. અદ્યતન માહિતી નિયમિત મેળવવા વેબસાઇટ www.brampton.ca/covid19 અને bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર @bramptontransit ને અનુસરો.

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca